

Gandhinagar, Monday, December 21, 2015

## GNLU PRESS NOTE

No. 25/2015

ગુજરાત નશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ના બંધારણીય અને વહીવટી કાયદા કેન્દ્ર દ્વારા  
આયોજિત

એક દિવસીય પરિસંવાદ જે

“ડૉ. બાબા સાહેબ આંબેડકર નું કાનૂની શિક્ષણ માં યોગદાન” પર આધારિત હતો.

સોમવાર, ૨૧.૧૨.૨૦૧૫

ગુજરાત રાજ્ય સરકારશ્રી ના સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ગુજરાત નશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર અને ગુજરાત આદિજાતિ વિકાસ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧.૧૨.૨૦૧૫ ને સોમવાર ના રોજ ગુજરાત નશનલ લો યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ માં સવારે ૦૮:૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી “ડૉ. બાબા સાહેબ આંબેડકર નું કાનૂની શિક્ષણ માં યોગદાન” વિષય પર એક સુંદર પરિસંવાદ નું આયોજન કરવા માં આવ્યું જે માં પ્રથમ બેઠક માં વંદે માતરમ રાષ્ટ્ર ગીત થી કાર્યક્રમ નો પ્રારંભ થયો



તેમજ GNLU ના નિયામકશ્રી પ્રોફ. (ડૉ.) બિમલ એન. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન થયું તેમજ બાબા સાહેબ આંબેડકરએ કાનૂન ક્ષેત્રે આપેલા પ્રદાન વિષે તેનો મહિમા સમજવ્યુ તથા GNLU ના આવા વિશિષ્ટ કાર્યક્રમો વિષે વાત કરી.

ત્યારબાદ કાર્યક્રમ ના મુખ્ય અતિથી શ્રી સંજય નંદન (IAS) જે ઓ ગુજરાત સરકાર ના વિકલાંગ વિભાગ ના કમીશનર છે. તેમને બાબા સાહેબ ના કાનૂન ક્ષેત્ર ના રાષ્ટ્રીય યોગદાન મહિમા સમજાવી આગનટુક વિવિધ ના લો ક્ષેત્ર ને



પસંદ કરનાર તેવા દલિત આદિવાસી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પ્રવચન કર્યું.



ત્યારબાદ પ્રોફ.અવિનાશ ભાગીચે સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત મુખ્ય મેહમાન તથા નિયામકશ્રી GNLU ડૉ. બિમલ એન. પટેલ વિદ્યાર્થી મિત્રો અને કાર્યક્રમ ને દરેક રીતે સફળ બનાવનાર તમામ સહયોગીઓ ને આભારવિધિ કરી હતી અને રાષ્ટ્ર ગાન સાથે સમગ્ર કાર્યક્રમ નું પ્રથમ સત્ર પૂર્ણ થયું.

બીજા સત્ર માં સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી) ના સમાજ શાસ્ત્ર વિભાગ ના પ્રોફ. ડૉ. જયપ્રકાશ ત્રિવેદીએ બાબા સાહેબ આંબેડકર ના કાનૂની યોગદાન વિષય પર સમીક્ષાત્મક વિદ્યાથી ભોગ્ય પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ત્રીજા સત્ર માં ડૉ. નિધિ બુચ અસ્સીસ્તંત પ્રોફેસર GNLU દ્વારા લોં માં પ્રવેશ અંગે ની માહિતી તથા વિવિધ નેશનલ લોં યુનિવર્સિટીઓ તથા કોલેજો માં પ્રવેશ અંગે ની માહિતી આપી હતી.



આ કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબ આંબેડકર નું ગુજરાત રાજ્ય માહિતી કમીશનર દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજી ફિલ્મ આવી તેમજ GNLU વિષે પણ માહિતી પ્રધાન ફિલ્મ દર્શાવામાં આવી.

કાર્યકર્મ ના અંતે મહેમાન તરીકે ઉપસ્થિત પ્રોફેસર. યશવંત વાઘેલા એ બાબા સાહેબ આંબેડકર ના કાનૂની ક્ષેત્રના વિવિધ વર્ગો માટે ની જોગવાઈઓ પ્રદાન સમીક્ષાત્મક ચર્ચા રૂપે ઉદાહરણ સહીત વાત કરી હતી જેમાં રાજકીય, અને વહીવટી સેવાઓ ની વિશે માહિતી આપી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રિસર્ચ અસોસીએટ શશીભૂષણ શર્માએ કર્યું હતું અને ગુજરાત ના વિવિધ આદિવાસી વિસ્તારોમાં થી પધારેલા વિદ્યાર્થીઓ એ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ની દર્શનીય મુલાકાત લીધી હતી.



\*\*\*\*\*